

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં. ૧૨ પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૬ થી ૮ -અન્ય માધ્યમ) વર્ષ ૨૦૨૧ કામચલાઉ મેરીટયાદી

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - અન્ય માધ્યમ) વર્ષ ૨૦૨૧ ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૩૦/૦૩/૨૦૨૧ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઈન અરજીઓ માંગવામાં આવેલ હતી. જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી <http://vsb.dpegujarat.in> વેબ સાઈટ ઉપર તા.૦૮/૦૬/૨૦૨૧ ના રોજ ૧૧.૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવારે તેમના TET પરીક્ષાનો નંબર, ભરતીનો પ્રકાર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાથી પોતાની વિગતો જોઈ શકશે. મેરીટક્રમ અને મેરીટગુણ તેમજ અન્ય વિગતો જોવા માટે વેબ સાઈટ ઉપર મુકેલ મેરીટની લીંક પર ક્લિક કરવાનું રહેશે.

- (1) વાંધા અરજી ઉપર ક્લિક કરવાથી ઉમેદવાર ઓનલાઈન વાંધા અરજી (સુધારા પત્રક) જોઈ શકશે. સુધારા પત્રકમાં ફોર્મ પ્રમાણેની વિગતો જેવી કે નામ, લાયકાત, કેટેગરી અને ગુણ/ટકા વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો આ વાંધા અરજીની હાર્ડ કોપી વેબસાઈટ પરથી ઓનલાઈન કાઢવાની રહેશે.
- (2) આપના દ્વારા અગાઉ ભરેલ ફોર્મની વિગતોમાં ક્ષતિ જણાતી હોય તો જે વિગતમાં ક્ષતિ જણાતી હોય તે તેની સામે દર્શાવેલ સુધારાપત્રકના કોલમમાં લખવાની રહેશે.
- (3) ઉમેદવાર મેન્યુઅલ ભરેલ સુધારા પત્રક તા.૦૮, ૧૦, ૧૧ જૂન ૨૦૨૧ ના રોજ ૧૧.૦૦ થી ૧૭.૦૦ કલાક સુધી મૂળ અરજીપત્ર જે સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવેલ હોય તે જ સ્વીકાર કેન્દ્રમાં બે નકલમાં રૂબરૂ જમા કરાવવાનું રહેશે.
- (4) સ્વીકાર કેન્દ્રએ સુધારા પત્રકની એક નકલ સુધારા અંગેના તમામ અસલ પુરાવાની ચકાસણી કરી આધારોની નકલ સાથે મેળવવાની રહેશે અને એક નકલ ઉમેદવારને સહી કરી પરત આપવાની રહેશે.
- (5) અરજીપત્રમાં દર્શાવેલી વિગતોમાં જ સુધારો કરી શકાશે. નવી કોઈ વિગત કે લાયકાત ઉમેરી શકાશે નહીં. રજૂ કરેલ સુધારો જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે.
- (6) ફાઈનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ બેટર વિગેરે માટેની સુચનાઓ હવે પછી વેબ સાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ <http://vsb.dpegujarat.in> વેબ સાઈટ જોતા રહેવું.

તા.૦૮/૦૬/૨૦૨૧

સ્થળ: ગાંધીનગર

ડૉ. એમ.આઈ.જોષી

અધ્યક્ષ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

અને પ્રાથમિક શિક્ષણ નિયામક

ગુજરાત રાજ્ય ગાંધીનગર